https://archive.org/details/bk590/page/n0/mode/1up

1908-10-27 -Imam Shah Bavana Prachha (590)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

યા અલી મદદ.

Full Library on https://realpatidar.com/library

શ્રી ઈમામશાહ બાવાના

પ્રછા.

કીંમત બે આના.

realpatidar.com

https://archive.org/details/bk590/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk590/page/n2/mode/1up

realpatidar.com

યાઅલી મદદ.

શ્રી ઈમામશાહ બાવાના

પ્રછા.

કીંમત બે આના.

realpatidar.com

https://archive.org/details/bk590/page/n3/mode/1up

realpatidar.com

યાઅલી મદદ.

શ્રી ઈમામશાહ બાવાના

પ્રછા.

છપાવનાર.

સૈયદ બાવા સાહેબ અહેમદઅલી.

સહાયકારી.

કાકા રામજી કરમસી કારભારી સાહેબ.

(આ પુસ્તક સન ૧૮૬૭ ના ૨૫ મા આક્ટ મુજબ રજીષ્ટર કરાવી કર્ત્તાએ સર્વ હક્ક સ્વાધીન રાખ્યા છે.)

અહેમદાબાદ.
"વિજય પ્રવર્ત્તક" પ્રિન્ટીંગ પ્રેસ.

સંવત ૧૯૬૫ ના કારતક સુદી ૨.

કીંમત બે આના.

realpatidar.com

realpatidar.com

માફી.

આ પુસ્તક મારી અજાણ કલમથી લખેલો હોવાથી માંહી અનેક પ્રકારની ભૂલચૂક રહી ગઇ હશે ? તે વિષે સુજ્ઞ વંચકો પાસેથી માફી માગું છું.

લી. આપનો શુભેચ્છક.

realpatidar.com

https://archive.org/details/bk590/page/n5/mode/1up

realpatidar.com

પ્રસ્તાવના.

સર્વ સુજ્ઞ વંચકોને નમ્રતા પુર્વક આ પુસ્તક નામે "શ્રી ઈમામશાહ બાવાના પ્રછા" આગળ મૂકી જાહેર કરૂંછું કે, પ્રથમ સને ૧૯૬૨, ની સાલમાં. મુબઈનાં પ્રેસમાં "ગુરે ઇમામ વાણી" ના નામથી છપાએલા હતા. પણ તેમાં ઘણોક સુધારો કરી હમોએ સરસ રીતથી છપાવરાવ્યા છે, કે જેથી વંચકોને વાંચતાં સુગમ પડે. વળી મોટા ટાઇપથી છાપેલ હોવાથી મોટી નજરવાળાને અગવડ આવે નાહિં. આ પ્રછાનુ પુસ્તક કલમી લખાણનાં રૂ ૧) એક માટે મલતા હોવાથી, કેટલાક લોકોને મોંઘા પડતા. તેથા આ છપાવેલો પુસ્તક ફકત. રૂ. ૧) ના આના જેવી નજીવા કીમતમાં આ અમુલ પુસ્તક મફ્ત કામતમાં મળે, તેટલાજ સારૂ પ્રયાસ કરેલો છે. તે શ્રી બાવાજી સાહેબ. શફળ કરે.

લેખક.

સૈયદ બાવાસાહેબ અહેમદઅલી

મુ. પીરાણા

પો. ગોરમથા

જી. અહેમદાવાદ

realpatidar.com

દેસ. ગુજરાત.

https://archive.org/details/bk590/page/n6/mode/1up

realpatidar.com

શ્રી ઇમામશાહ બાવાના

પરછા.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો, જુગમાં જાણો અજિતજી;
જાગતી જોત જાંબુદ્વિપમાં, જાણે ઉગ્યો ઉદ્દતજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧

ગ્રામ ઘણા ધરતી ઉપરે, તીરથ તીરથના ઘાટજી;
એવા શુંદિર જગ્યા શોભતી, એવો આવે નહિ કંઇ ઠાઠજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૨

રોજા જોઇને રાજી થઇએ, આનંદ ઉપજે મન માંહેજી;
આઠ પોહોર ને ચોસઠ ઘડી, સુખે રહાયે ત્યાંએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૩

પ્રથમ કહું પીરાણા તણું, વિગતે કરૂં વિસ્તારજી;
અલ્પ બુદ્ધિએથી ઓચરૂ, ગોર મોરી લજ્જા રાખણહારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૪

ગોરભિસ્ત થકી આવીયા, આવ્યા દુનિયાની માંહેજી;
હાજર બેગ હજુરમાં, હુકમ માને છે ત્યાંએજી.

realpatidar.com

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૫

https://archive.org/details/bk590/page/n7/mode/1up

realpatidar.com

હાજર બેગ સોબતે આવીયા, આવ્યા વન ખંડિ માંહેજી;
એક લૂટારો ચોર ત્યાં વશે, લૂટવા આવ્યો ગોરને ત્યાંએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૬

સનમુખ આવા ઉભો રહ્યો, તીર ચડાવી કમાનજી;
ત્રિલોકાનાથ જાણ્યા નહિ, કામઠું ખેંચ્યું કમાનજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૭

ધણીનો પ્રછો ત્યાં ઢુંકડો, કામ કેવાં કરે તેણી વારજી;
લૂંટારા તણો હાથ ઉંચો રહયો, તીરનાં છૂટયો લગારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૮

પ્રગટ પ્રછો જયાં દેખાડીયો, આવી પડયો ગોરને પાએજી;
અનાથ બંધુ ઓળખ્યા નહિ, માફ ગુનો કરો સાહેજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૯

અરજ કરી કહ્યું એટલું, ભવોભવ આપનો દાસજી;
વિચળ ભકિત આપો આપની, રાખો ચરણની પાસજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૦

અનંત પ્રકારે અરજ કરી, ક્રિપા કરી દયાવંતજી;
શેવક જાણીને સાથે લેવા, ખબર લીધી ખુદાવંતજી.
realpatidar.com
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૧

https://archive.org/details/bk590/page/n8/mode/1up

realpatidar.com

પ્રથમ પ્રછો એરે, પૂરીને, આવ્યા સાબરમતિ તીરજી;
ત્યારે આવી કામ કેવાં કર્યાં, સુણો સૌ મોમન વિરજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૨

રામ છપ્પો.

હુકમ કર્યો હજુર, હોડી વાલાને ત્યાંહ;
જાવું પૂર નદી પાર, વચન સુણો તું ભાઈ;
દયોને દોઢા દામ, પ્રથમ ઊતારો અમને;
કામ કરો જરૂર, રાજી કરીશું તમને,
હોડી વાલો એમ બોલિયો, વારા ફરતી ઉતરે સહી;
ઉતાવળ હોયજો એવડી, તો મારગ મોકળોછે અહી. ૧

realpatidar.com

https://archive.org/details/bk590/page/n9/mode/1up

realpatidar.com

સદ્ ગોર સુણી કાન, વચન બોલ્યા જે એવાં;
હાજર બેગને કહ્યું, કામ કરો કહું તેવાં,
અલી નબીનું નામ, લેઈ પૂરમાં જઇ પડિએ;
ગાડી નાખો પૂરમાં, સહી કોને નવ નડીએ,
નામ નબીનું લેઇ કરી, ગાડી સોત ઉતર્યા સહી;
કહે બંધુ દાશ બે, સૌ અચરત પામ્યાં તહીં. ૨

પ્રગટ પ્રછો ત્યાંએ, ગોરે દેખાડયો જયાંઇ;
હોડીવાલો મનમાંહી, વિલાપ કરેછે ત્યાંઇ,
મુજ પાપતણો નહો પાર, પ્રભુનાં વચન નાં માંન્યાં
મુજ પાપ તણો નહિ પાર, આદ પુરૂષ નવ જાણ્યાં,
મુજ પાપતણો પાર આવે નહિ, ઘેર ગંગા આવી સહી;
કહે બંધુ બે અભાગિયા, જગતાર જાણ્યા નહિ. ૩

વિપરીત જોઇને વાત, ગયો ગોર પાસે જયાંહીં;
ગુનો માફ કરાવવા, ચિત્તમાં એવું ચાહી,
સૌને પૂછતો જાએ, ભલી રીતે પણ ભમિયો;
વાટ ઘાટ સૌ જોઇ, જંગલમાં જઇ ડમીયો,
અકળ કળા એ ગોર તણી, તે કોઇ નવ કળે સહી;
કહે બંધુ બે તેહને, દરસન પણ દીધાં નહિં. ૪

realpatidar.com

https://archive.org/details/bk590/page/n10/mode/1up

realpatidar.com

રાગ પ્રછાનો.

પ્રગટ પ્રછા એવા પૂરીને, આવ્યા ગરમતે ગામજી;
મુકામ કર્યો સરોવર વિષે, કેવા કર્યા તઇં કામજી,
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩

હુકમ કર્યો હાજર બેગને, જાવો પટેલની પાસજી;
પટેલને જઇ તમે એમ કહો,મુજ ગોર આવ્યા આગે વાસજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૪

હાજર બેગ ત્યાંથી ચાલીયા, ગયા પટેલની પાસજી;
હુકમ કર્યો મારા ગુરૂજીએ, આપો મુજને ઘાંસજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૫

ત્યારે પટેલ એમ બોલીઓ, ઘાસ નહિ મળે કાંઇજી;
સાત દુકાળી કાળ અહિં પડયો, મેહ નાં વરષે લગારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમાનનો. ૧૬

સાચો હોયજો તારો સતગુરૂ, મેહ વરસાવે આણી વારજી;
ચાર આપું ઘાસી પેરની, થાએ અમતમ તણું કારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઈમામનો. ૧૭

શોકાતુર થઇ પાછા ફર્યા, આવ્યા ગુરૂજીને પાસજી;

realpatidar.com

https://archive.org/details/bk590/page/n11/mode/1up

realpatidar.com

અબોલા આવીને બેઠા આસને, મનમાં થઇને ઉદાસજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૮

અંત્તર જામીએ ત્યાં જાણીયું, હાજરબેગને પૂંછે વાતજી;
કીયેરે કારણ શોકાતૂર થયા, વિસ્તારીને કહો વાતજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૯

અરજ કરી ઉભા રહ્યા, ગોર મોરી લજ્જા રાખણ હારજી;
મેહ વરસાવો મંચ્છા કરો, તો થાએ આપણું કાજજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૨૦

ખુશી થઇ ખુંદાવંત બોલીયા, નિશ્ચે કરોને નીરાંતજી;
પટેલને જઇને જાહેર કરો, મેઘ મંડાશે મદ્ધ રાતજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૨૧

આનંદ થઇને ઉઠીયા, ગયા પટેલની પાસજી;
ગોરે કહ્યું એવું, જઇ કીધું, તો પટેલે આપ્યો ધાંસજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૨૨

રાત પડી રમતમાં, ગોરે કીધો છે કીરપાએજી;
હાજર બેગની અરજ સુણી; ગોરે કેવાં કીધાં કામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૨૩

ઉત્તર માહેંથી ઉલટયો, થૈ રહ્યો છે અંધકારજી;
ધણીનાં ધુંમાકા ત્યાં વાગીયા, મેહ વરષે મુસળ ધારજી.

https://archive.org/details/bk590/page/n12/mode/1up

realpatidar.com

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૨૪

જલવિજલ ત્યાં થૈ રહી, રચી રહી રંગની રેલજી;
ત્રાહી ત્રાહી સૌકો કરે, ત્રાહી કરે પણ પટેલજી.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૨૫

સલામે આવ્યા સદ્દગોર તણી, મનુષ્ય માત્ર તાંહેજી;
પ્રથમ પટેલ પણ આવીઓ, તેં મોટૂં કૌવતક થાએજી.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૨૬

સરોવરપર સદ્દગોર તણો, તંબુ દીઠો તરતાએજી;
અરજ કરી સૌ ઉભા રહ્યા, હવે કેમ કરીને જવાએજી.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૨૭

અરજ કરી જ્યાં ઇમાનને, ગોરે કરી છે કિપાએજી;
રૂમાલ નાખીને બોલાવિયા, લળી લાગો સૌ લાગે પાએજી.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૨૮

ભલે પ્રભુજી પધારિયા, અમ શેવકની લેવા સાએજી;
ભલેરે ભૂતાળ વિષે આવિયા, કિપા કરી આપો આપજી.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૨૯

પાએ નમી પટેલ બોલીઓ, ગોર માગું એક વચનજી;
આપ ફરમાવો તે કીજીએ, કિપા કરો આપોઆપજી

realpatidar.com

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૩૦

https://archive.org/details/bk590/page/n13/mode/1up

realpatidar.com

ખુશી થઇ ગુરૂજી બોલીયા, મારે જોઇએ નહિ કાંએજી;
તીર ફેંકું મારો જ્યાં પડે, જગ્યા બંધાવું ત્યાંએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૩૧

એવી રીતે કરાર કરી, કબુલ કર્યું સર્વે ત્યાંએજી;
પટેલ પગ પાએ લાગીઓ, આનંદ ઉરમાં ના માએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામયો. ૩૨

ત્રિલોકો નાથે તીર ફેંકીઓ, જઇને પડયો છે જેઠારજી;
તેરે ઠેકાણે મોટો સિંહ વશે, ચાલી નીકળ્યો તેણી વારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૩૩

ગોર બ્રહ્મા પ્રગટ થયા, શુંદિર બનાવ્યું ત્યાં ધામજી;
જયજયકાર સૌને વાપિયો, તે પીરાણા પાટણ નામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૩૪

એક વારતે જગ્યા વિષે, મેહનત કરતા મજુરજી;
ગાદી હેઠેથી નાણું આપતા, પાસે બોલાવી હજુરજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૩૫

એક મજુરે મન વિચારીયું, ગાદી હેઠે નાણું અપારજી;
રાત પડે આવી લેઈ જઉં, એવો કર્યો છે વિચારજી.
realpatidar.com
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૩૬

https://archive.org/details/bk590/page/n14/mode/1up

1908-10-27 -Imam Shah Bavana Prachha (590)

realpatidar.com

રાત પડે તે આવીઓ, ખોદી તપાશ્યું તમામજી;
એક પૈસો પણ જડયો નહિ, કઉત્તક કર્યું ગોર ઇમામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૩૭

સાંજ બીજી જ્યારે પડી, મજુરને આપે છે દામજી;
ચોર મજુરને બોલાવિયો, બમણું આપે તેને દામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૩૮

તે મજુર ત્યારે બોલીયો, બાવા બમણું નાં હોયેજી;
બીજા મજુરોએ વિચારીયું, આ કારણ શું કેહેવાયેજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમાનનો. ૩૯

તારે ગોરઇમામશાહ બોલિયા, બચ્ચા તેરી બોહોત મજુરીજી;
રાતે શંકટ તને બહુ પડયો, માટે લોને બમણા દામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૪૦

એવી રીતે મજૂરની, ખબર લીધી ખુદા વંત્તજી;
દોષ દલમા તેનો નવ ગણ્યો, આપે થયા દયાવંત્તજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૪૧

એક સમે મહમદ બેગડો, અમદાવાદનો બાદશાહેજી.
પારખું લેવા પંડે આવીયો, મનમાં કરીને ઠરાવજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો.

realpatidar.com

https://archive.org/details/bk590/page/n15/mode/1up
1908-10-27 -Imam Shah Bavana Prachha (590)

realpatidar.com

મહમદ બેગડો એમ બોલીયો, ભલા જમોને ભોજનજી;
એમ કહીને આગળ ધર્યો, કપટ કરી આણ્યો ત્યાંએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૪૩

ત્રિલોકીનાથે ત્યાં જાણીયું,બાદશાહઆણ્યો પારખા લેવાયેજી;
શ્રોતાજન સૌ શાંભળો, ધણી મારો કેવાં કરે કામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૪૪

ત્યારે ગોર ઇમામશાહએમબોલીયા,સભા સુણોસૌતમામજી;
ક્યાએકું બચ્ચારે બિલ્લી મરપડી, ઉઠજા તેરે મૂકામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૪૫

ગોર મુખથી જ્યાં બોલીયા, આળશ મરડીને ઉભી થાએજી;
ઉઠી આવી ગોરને પાએ પડી, ત્યાંથી ચાલી તે જાએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૪૬

પ્રગટ પરછો દેખાડીઓ, સૌને થયો છે આનંદજી;
બાદશાહનું મન માન્યું નહિ, એવો છે મતિમંદજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૪૭

બીજું ફરીને કઉત્તક કર્યું, શ્વાંશ લાવ્યો તેણી વારજી;
ી શ્વાંશ ની મૂકી આગળે,ભોજન જમો શુંદિર સારજી;
realpatidar.com
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૪૮

https://archive.org/details/bk590/page/n16/mode/1up

realpatidar.com

ધણુાને પ્રછો ત્યાં ઢૂંકડો, ધણી મારો કેવાં કરે કામજી;
રૂમાલ ઢાંકેલો ઊંત્રાડીયો, લવિંગ સોપારી તમામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૪૯

સભા સૌને વહેંચ્યાં આપીયું, લળી લળી સૌ લાગે પાએજી;
જગત ઓધારણ ભલે આવીયા, ધન ધન ગોર ઈમામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૫૦

ફરી પ્રછો એવો પુરીયો, બાદશાહ બૂજ્યો નહિ મનમાંહેજી;
ત્રીજું કૌવતક ફરી તૈ કર્યું, સભા સૌ બેઠી ત્યાંએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૫૧

ઝેર દુધમાં નાંખીયું, પાવા લાગ્યો ગોરને પાસજી;
મીઠા મેવા જુગતે જમો, દિલમાં કૂડો છે વિચારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૫૨

ગોર બ્રહ્મા ઝેર પી ગયા, સ્કંલ્પ કરી ગયા આપજી;
સભા સહુ અચરત થઇ, મોટા કોઈક આવ્યા પીરજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૫૩

સભા સૌ ખુશી થઇ, લળી લળી લાગે સૌ પાએજી;
દયાવંત્ત દિલમાં દયા કરો, કોટિક પાપ કરો માફજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૫૪

realpatidar.com

https://archive.org/details/bk590/page/n17/mode/1up

realpatidar.com

અવતાર થયો અવની વિષે, પધાર્યા ભકત તારણુહારજી;
ધન તાત માત અમ તણા, આપે દીધાં છે દિદારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૫૫

બાદશાહ પગે પડયો ગોર તણે, અરજ કરેછે અરદાશજી;
અનાથ બંધુ માંગું એટલું, માફ ગુનો કરો હું દાશજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૫૬

જગતતારણ જાણ્યા નહિ, ના જાણ્યા ત્રિભોવન રાએજી;
દાશ ઉપર દયા લાવીને, ક્રિપા કરો આપો આપજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૫૭

અરથ ગ્રથ માંગો ઉલટથી, આપું ગામ ને ગરાશજી;
આપ ફરમાવો તે હાજર કરૂં, રાખો ચરણની પાસજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૫૮

ગોર બ્રહ્મા એમ બોલીયા, મારે જોઇએ નહિ કાંએજી;
રાજી ખુશીથી તમો રાજ કરો, તમે જાઓ તમારે મુકામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૫૯

એમ કરી પ્રણવીએ, બાવા બેટી અમતણીજી;
અરજ માંગી ત્યાંથી ચાલીયો, ગયો પોતાને મુકામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૬૦

realpatidar.com

https://archive.org/details/bk590/page/n18/mode/1up

realpatidar.com

પ્રગટ પ્રછો એવો પૂરીયો, ધણી મારો કેવાં કરે કામજી;
અકળ કળા કોઇ નવ કળે, ધન્ન ધન્ન ગોર ઇમામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૬૧

મોટું કામ એક ગોરે કર્યું, એછે અનાથનો નાથજી.
જે કોઇ આવે તેના ચરણ વિષે, ધણી મારો હેને ઝાલે હાથજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૬૨

રહેવાશી સોઢગર શેહેરનાં, લવાણા બ્રાહ્મણનો સાથજી;
તેનાં ગોરે કામ કેવાં કર્યાં, શુણો મુમન તેની વાતજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૬૩

સરવે મળી સંઘ કાઢીયો, ચાલ્યા કાસી તીરથ વાટજી;
ચાલતાં ચાલતાં ત્યાં આવીયા, આવ્યા પીરાણાને ઘાટજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૬૪

પડાવ કર્યો પાદર વિષે, સંઘ ઢળીયો તમામજી;
દર્શન કરવા સાજન ચાલીયા, શુંદિર જોવાને ધામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૬૫

સંઘવી સર્વ ત્યાં આવીયા, શુંદિર જોયો મુકામજી;
સલામ કરી ત્યાં સદ ગોરને, પૂછે ગોર ઇમામજી.

realpatidar.com

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૬૬

https://archive.org/details/bk590/page/n19/mode/1up

realpatidar.com

ખુશી થઇ ગુણવંત બોલીયા, કોન મુલક સંચરેનાજી;
કોન મુલક જાના તુમ સહી, કયા કારણ હે તુમારેજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામના. ૬૭

સંઘ વાળા સર્વ ત્યાં બોલીયા, ઉત્તર દીધો તેણી વારજી;
કાસી તીરથ બાવા જે કહિયે, હમારે જાવું છે ત્યાંએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૬૮

દિદાર કરવાને આવીયા, જોવા જગ્યા તણો ઠાઠજી;
કાલે અહાંથી હમો ચાલશું, જાશું કાસી તીરથ ઘાટજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૬૯

ત્યારે ગોર ઇમામશાહ બોલીયા, પ્રેમે જોઇ સૌનાં મનજી;
કિપા ધરી દાશ ઉપરે કરા, મેહેર કરી તેણી વારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૭૦

તીરથવાસી સબ સુણો, તમે જાણો કાસી ઘાટજી;
દીદાર પાવોગે કાસી તણા, ઇચ્છા હોયગી તમારીજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૭૧

સહ ગોરને સૌ પાએ પડ્યા, અરજ સુણો ગોર ઈમામજી;
દરશન દેખાડો કાસી તણા, દયા કરીદો દિદારજી.
realpatidar.com
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૭૨

https://archive.org/details/bk590/page/n20/mode/1up

realpatidar.com

અરજ કરી ત્યાં ઇમામને, દયાવંત દુઃખ કરો દુરજી;
આપ ફરમાવો કાંજીએ, પ્રેમ ભકિત જોઇ ભરપૂરજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૭૩

તારે ગોર બ્રહ્મા એમ બોલીયા, આ જાઓ તુમારે મુકામજી;
ઇચ્છા હોગી શો પાવગે, કલ કાનીકા દેખોધામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૭૪

વચન સુણી સો ગોર તણા, આવ્યા પોતાને મુકામજી;
એરે વાતતો એટલે રહી, ધણી મારો કેવાં કરે કામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૭૫

દુઃખ નીવારે દયા કરી; એછે અનાથુંનો નાથજી;
ક્રિપા કરી દાશ ઉપરે, ધણી મારો હેતે ઝાલે હાથજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૭૬

ગોર બ્રહ્મા અંતરધ્યાન થઇ, આપે પોહોચ્યા વૈકુંઠ ધામજી;
ચરિત્ર એના કોઇ જાણે નહિ, ના જાણે પોતાનો હોયે દાશજી
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૭૭

આપે જયાં અંતરધ્યાન થયા, ના મળે જગ્યામાં તે વારજી;
કાંકા સહુ શોધવા લાગીયા, કારણ બન્યું શું કિરતારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૭૮

realpatidar.com

https://archive.org/details/bk590/page/n21/mode/1up

realpatidar.com

શોકાતૂર સૌ શેવક થયા, મનમાં થયા બહુ ઉદાસીજી;
વિલાપ કરી ઠામો ઠામ જૂએ, ગયા કયાં જાંબુદ્વિપનાં વાસીજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૭૯

અરજ કરે સો ઇમામને, ગોર મારી લજ્જા રાખણહારજી;
છલ કરીને અમને છેતર્યા, એમ નાં કીજે કિરતારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો ૮૦

વૈકુંઠપતી વિચારીએ, લજ્જા રાખો આણી વારજી;
નહિ આવો અવશર વિષે, જાશે તમારી તે લાજજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૮૧

દુઃખ નીવારે દયા કરો, પધારો પીરાણાની માંહેજી;
આરે અવસરે જો આવો નહિ, દેહ તજીએ હમો સારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૮૨

એવી ટેક અંતરમાં ધરી, બેઠા આશન વાળીજી;
નામ ઇમામનું લેઈ કરી, દેહી તજયાનો કરે ઉપાએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૮૩

પોકાર કરે સૌ શેવકો, આપે જાણ્યું વૈકુંઠવાશીજી;
ભીડ પડીરે મારા ભકતુંને, દુઃખે દુભાણા મુજ દાશજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૮૪

realpatidar.com

https://archive.org/details/bk590/page/n22/mode/1up

realpatidar.com

એવું જાણી આપે આવીયા, પ્રગટ થયા પીરાણા માંહેજી;
ભિસ્ત થકીરે ગંગા લાવીયા, રાખી પોતાની પાસજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૮૫

દીદાર થયા સો દાશને, કિરપા કરી તેણે વારજી;
પ્રેમ સહિત ગોરને પાએ પડ્યા, થઇ રહ્યોછે જયજયકારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૮૬

ધન્ન ધન્ન વૈકુંઠનાથને, ધન્ન ધન્ન ગોર ઇમામજી;
ભકત કારણ કામ કેવાં કર્યાં, ગંગા લાવ્યા ભિસ્તથીભોમજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૮૭

એ વાત તો એટલે રહી, તિર્થવાશીનું થયું કામજી;
ગુરૂને પરતાપે સો બની રહ્યું, સર્વે સૂતાછે ત્યાંહીજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૮૮

રાગ દોહરો.

દેવ ઘણા દુનીયા વિષે, ગણતા ન આવે નેક;
પરગટ દેખો પારખું, ગોર ઇમામ છે એક. ૧

જુગમાં જાણે એક હે, અવરમાં જાણો કોઇ;
ગોર નરને દો માનશે, દોજક જાશે સોઇ. ૨

realpatidar.com

https://archive.org/details/bk590/page/n23/mode/1up

realpatidar.com

રાગ છપ્પો.

ભરનિંદ્રા ભરપૂર, સો સૂતાછે જ્યાંહી;
ત્રિલોકીનાથે તતકાલ, માયા રચાવી ત્યાંહી;
બન્યું કાસીપુર ધામ, મુકામ બન્યા ત્યાં બંકા;
તેને કરતાં સોવાર, દેસમાં જસનાં ડંકા;
ભકત કારણ કામ કેવાં કર્યાં, ધન્ન ધન્ન ધણી કહેવાય છે;
કહે બંધ્ધુ તિર્થવાશી તણા, જન્મનાં દુઃખડાં ટળી જાય છે. ૧

સુકરિત કરીને કામ, મુકામ પોતાને આવ્યા;
ટળ્યા ત્રિવિધીતાપ, મહા અમ્મર ફળ પાળ્યા;
તેના પુન્ય તણો નહિ પાર, હેતે ગોરે હાથ ઝાલ્યો;
તેના પૂન્ય તણો નહિ પાર, ચોરાસી ફેરો ટાલ્યો;
અમ્મર ડંકો દેઇ કરી, રાતે સતા સો સહી;
કહે બંધ્ધુ પ્રભાતમાં, કોત્તક કશું ભાળે નહિ. ૨

રાગ પ્રછાનો.

સુંતા કેડે ગોરે શું કર્યું, માયા શંકેલી તેણી વારજી;
સો સોને ઠેકાણે થયા, કામ કેવાં કરે કિરતારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો; ૮૯

realpatidar.com

https://archive.org/details/bk590/page/n24/mode/1up

realpatidar.com

સુતા સવારે સૌ જાગિયા, કૌત્તક મોટું કહેવાયજી;
આરે કારણ શું નીપનું, ગોરે કરીને કિપાએજી.
પ્રગટ પ્રછે રે ગોર ઇમામનો. ૯૦

એવું જાણી ત્યાં સૌ આવીયા, આવ્યા ગુરૂજીની પાસજી;
પ્રેમ સહિત ગોરને પાએ પડયા, છૈયેં તમારા દાસજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૯૧

ભલે પૃથ્વીમાં પ્રગટ થયા, સેવકની સેવા સારજી;
શેવક જાણી રાખો ચરણ વિષે, ધન્નધન્ન જંબુદ્વિપના રાયેજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૯૨

રાગ છપ્પો.

ધન્ન ધન્ન ગોર ઇમામ, પ્રથમ દીદારજ પાય;
ધન્ન ધન્ન તમ પ્રતાપ, કાસી દીદાર દીખાયા;
ધન્ન ધન્ન તમ પ્રતાપ, સ્નાન ગંગામાં કીધા;
ધન્ન ધન્ન તમ પ્રતાપ, દાન બ્રાહ્મણને દીધા;
પ્રગટ પ્રતાપ છે તમ તણો, દાશ રૂદે દેખ્યા સહી;
કહે બંધ્ધુ કોઇ કળા કળે, ભોમી ઉપર ભાળ્યો નહિ ૧

realpatidar.com

https://archive.org/details/bk590/page/n25/mode/1up

realpatidar.com

રાગ પ્રછાનો.

અનંત પ્રકારે અરજ કરી, ભવોભવ આપના ગુલામજી;
કિરપા કરીને શેવક કરો, અરજ સુણો ગોર ઇમામજી
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો ૯૩

પ્રબોધ દીધો પ્રેમથી, જનોઇ ઉતારી છે ત્યાંએજી;
નામ રૂપી જનોઇ પેરીએ, એવું બોલ્યા સૌ તાએંજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૯૪

સર્વે જનોઇયું ઉતારીયું, ઉતારી ગણુતે સવાએજી;
તાંથી સૌએ ગોર થાપીયા, શેવક થયા સૌ ત્યાએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૯૫

ગોરે સૌ શેવક તણા, ખોજા ઠક્કર ધરાવ્યા નામજી;
જગત તારણ છે રે જાગતો, ધણી મારો કેવાં કરે કામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૯૬

પંનજો ગોરનો જાહેર છે, નાંનાં રોજાની માંહેજી;
હાલ જનોઇ છે કાયમ તહીં, જૂવે સૌ વારંમવારજી.
realpatidar.com
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૯૭

https://archive.org/details/bk590/page/n26/mode/1up

realpatidar.com

પછે ગોરે શું કર્યું, ગંગાતણું વરણામજી;
શેવક સારૂં ગોરે કેવું કર્યું, સુણો ચુમન થઇ એક મનજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૯૮

ગોરે કુવો ગળાવીયો, ગંગવો કુવો જેનું નામજી;
થોડી ગંગાજી માંહે મુકીયા, બીજી કબરની હેઠજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૯૯

ધન્ન ધન્ન ગોર ઇમાદિન, ધન્ન ધન્ન તમારો અવતારજી;
ભક્તું કારણ કામ કેવાં કર્યાં, દુઃખ નીવારે તું દાતારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૦૦

પાંચ શેવક પીર આળખ્યા, વિગતે કહુ તેમનાં નામજી;
શ્રોતા જન સૌ સાંભળો, ગોરે કર્યાં તેમનાં કામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૦૧

હાજર બેગ હજુરમાં, પ્રથમ હતા ગોરની પાસજી;
સત્ મુસલમાન તેનો સહી, દુજા નાયા કાકા દાસજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૦૨

તે પણ જાતે કોળી હતા, ગોરે હેને ઝાલ્યો હાથજી;
ત્રીજો શેવક લેવો કણબી કેયે, સાગ્રા કાકા જેનું નામજી.

realpatidar.com

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૦૩

https://archive.org/details/bk590/page/n27/mode/1up

realpatidar.com

ચોથા શેવક ભાભારામ કૈયે, તે પણ કણબી કહેવાયેજી;
પાંચમા શેવક કીર્કાબાઇ કહીયે, ભાભારામની બેનજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૦૪

શેવા કરી પાંચે ગોર તણી, પ્રેમ ભકિત ભરપૂરજી;
શેવક જાણીને વચન દીધાં, દોહેલાં દુઃખ કર્યાં દુરજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૦૫

સત્ ગોર મુખથી ઓચર્યા, સુણો હાજર બેમ હુજુરજી;
અમે કૈયે તે તમે પામશો, નિશ્ચે જાણજો જરૂરજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમાનનો. ૧૦૬

હક થાશે દેહ જ્યારે માહરો, દેહ પછી પડશે તમારોજી;
વીસ કદમ છેટે તગતણી, થાશે કબર વચન હમારોજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૦૭

પેહેલી સલામ તમને ભરે, ફુલ ચડે કબર તમારીજી;
પેહેલાં આવી સૌ તમને નમે, પછે નમે કબર હમારીજી,
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૦૮

કબર તમારી ઉપરે, ગમે તેવો પડે તાપજી;
શીતળ સદારે કબર તમતણી, એવું મોટુ રાખ્યું માપજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૦૯

realpatidar.com

https://archive.org/details/bk590/page/n28/mode/1up

realpatidar.com

શેવકને સનમાન દીધા, વચન પ્રમાણે થયું તેમજી;
પેહેલી સલામ હાજર બેગને, શીતળ કમરછે સદાએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૧૦

હાજર બેગને વેણુ આપીયું, નાયાકાકાને કીધા ન્યાલજી;
અખંડ ભકિતરે ભલી એમની, અંતરે ઉપન્યું વ્હાલજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૧૧

નાયાકાકાને ગોરે એમ કહ્યું, કાનમ પ્રગણે કુકરા ગામજી;
તેં જાઓ વચન અમતણો, શુંદિર બનાવો જઇ ધામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૧૨

માનતા ચાલશે તમ તણી, માણસ મળશે અપારજી;
એવાગોરના અમુલગાન મળ્યા.નાયાકાકાનોધન્ન અવતારજી
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૧૩

શાણા કાકા જે શેવક કૈયે, ગોરે આપ્યું અવિચળ વચનજી;
પ્રેમ ભકિતરે ભલી એમની, ક્રિપા કરી રીઝયા મનજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૧૪

ખુશી થઇ ખુદાવંત બોલીયા, શેવજો ગાદી સત્ ઉપાએજી;
ધન્ન ધન્ન અવતાર શાણાકાકાનો,ઘણાં ગારે કરીછેક્રિપાએજી
realpatidar.com
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૧૫

https://archive.org/details/bk590/page/n29/mode/1up

realpatidar.com

કણબી કહેવાયે જાતના, ગોરની શેવા બહુ સારજી;
દુઃખડાં ટાળી અવિચળ ગાદી સોંપી, શેવા ફળ પામો સારજી
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૧૬

પછી ભાભારામ ભકત ભલા, ગોરે વેણ આપ્યું એમજી;
તમેરે જાઓ ચરોતર વિષે, હું કહું તે કરો તેમજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩૭

પેટલાદ પ્રગણા વિષે, દેવાગામ કહીયે જેહજી;
ત્યાંરે જઇને મુકામ કરો, ભલા બનાવોને ધામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૧૮

કીકીબાઇ શેવક કૈયે, ભાભારામની બેન થાએજી;
તેને ગોરે વચન એ કહ્યાં, કીકીબાઈ સુણો તાંએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૧૯

સત્ત ગોર મુખથી બોલીયા, અભી સુણો કીકીબાઇજી;
દેવા ગામથી એક ગાઉ પર, ગામ વસાવો તમે તાંએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૨૦

અમારા જેવી ત્યાં તમતણી, માનતા ચાલશે મનમાનીજી;
જાત્રા કરવા સૌ જન આવશે. ગુણ ગાશે ગુણી જનજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૨૧

realpatidar.com

https://archive.org/details/bk590/page/n30/mode/1up

1908-10-27 -Imam Shah Bavana Prachha (590)

realpatidar.com

ભાઇ બેન બે આનંદ થઈ આવીયા, ગોરે કીધું તે ઠામજી;
ત્યાંરે આવીને મુકામ કર્યો, શુંદિર બનાવ્યું ત્યાં ધામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૨૨

ગાઉ પર કીકીબાઇએ, શુંદિર વસાવ્યું એક ગામજી;
તેરે ગામનું નામ તમને કહું, કીકીબાઇની રૂણ કહેવાયજી.
પ્રગટ મછોરે ગોર ઇમામનો. ૧૨૩

પ્રેમે સુખ પમાડયા પાંચને, કિપા કરી શંકટ કાપ્યાજી;
શેવક પોતાના જાણી કરી, વાલે મારે અભેપદ આપ્યાજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૨૪

ફળ મળ્યું શેવા તણું, મનમાં જુઓ સૌ વિચારીજી;
બંદગિ કરશે તો બાવો બેડી તારે, એવા ગોર પ્રઉપકારીજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૨૫

એવું જાણી સૌ મુમનો, નિત્ત નિત્ત ગોરનું લીજે નામજી;
ગોરનર સાચા કરી માનજો, તો જાશો વૈકુઠ ઠામજી
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૨૬

એવા કામતે કાયમ છતાં, ગોર મારે જસનાં ડંકા દીધાજી;
પડદે થયા પછે શું થયું, કળી કાલમાં કીધા કામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૨૭

realpatidar.com

https://archive.org/details/bk590/page/n31/mode/1up

realpatidar.com

એક સમે ગોરો આવીયો, આવ્યો જગ્યાની માંહીજી;
જોડા સહિત પંન્ડે આવીયો, બીકના આણી લગારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૨૮

કાકા સર્વે કેવા લાગીયા, જોડા ઉતારોને બારજી;
અમારા ગોર બેઠા રોજા વિષે, એમ કહીને સમજાએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૨૯

ગોરાએ કહ્યું કર્યું નહિ, ગયો રોજાની માંહીજી.
ગુરૂજીએ પ્રછો દેખાડીયો, દેખાડયો તેણીવારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩૦

ગોરો ત્યાંથી ચાલીઓ, ગઓ પોતાને મુકામજી
તંબુ નાખ્યો તો પાદર વિષે, નાખ્યોતો ગરમતે ગામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩૧

રાત પડે ગોરો સુઇ રહયો, સુતો નિંદ્રા ભરપૂરજી;
ધણી મારે ઢોલીયો ઉડાડીઓ, ઉડાડયો સીમાડા તે દૂરજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩૨

એક તરફ ઢોલીયો જઇ પડયો, આપ પડયો જઈ એકાંતજી;
માનવી કોઇ દીઠું નહિ, ગોરનું રાખ્યું ના માપજી;
realpatidar.com
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩૩

https://archive.org/details/bk590/page/n32/mode/1up

realpatidar.com

સુદ્ધ આવી સરીરને, જુવે ચારે પાસજી;
બીજું કાંઇ નજરે ભાસે નહિ, ભાસે ભોમોને આકાશજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩૪

અરજ કરી ત્યાં ઇમાગને, પાછો આવ્યો ગોરની પાસજી;
બન્યો ગુનેગાર તમતણો, માફ ગુનો કરો સાએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩૫

ત્રીલોકી નાથ જાણ્યા નહિ, ના જાણ્યા જુગનો કિરતારજી;
મુર્ખ મનમાં સમજ્યું નહિ, કહ્યું કર્યું નહિ લગારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩૬

સતૂ ગોરને છત્ર બંધાવીયું, વિનતી કરે વારંમવારજી;
દાશ જાણીને દયા કરો, ત્રિલોકી તારણહારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩૭

વિધ વિધ પેરે વિનવે, દુર કર્યું ગોરે દુઃખજી;
કિપા દ્રઢ દાશ ઉપરે કરી, ત્યારે સરીરે થયો સુખજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩૮

એવી રીતે તેને સુખ થયો, એવા પ્રમ સુખકારીજી;
પારખાં લેવા આવ્યો ગોર તણા,પ્રછો દેખાડી કર્યું સુખભારીજી
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૩૯

realpatidar.com

https://archive.org/details/bk590/page/n33/mode/1up

realpatidar.com

એવા પ્રછાતે અપાર છે, કેટલા કહું વિસ્તારીજી;
એટલી બુદ્ધિ પહોંચે નહિ, થોડામાં કહું વિસ્તારીજી.
પ્રગટ પ્રછોરે ગાર ઇમામનો. ૧૪૦

એક સમે એ જગ્યા વિષે, ગોરે કર્યું એક કામજી;
પ્રગટ પ્રછો એવો પૂરીયો, સૌ સુણો મુમન વિરજી.
પ્રગટ પ્રછોરે ગાર ઇમામનો. ૧૪૧

ધજાગરો ધણીનો કેચે, બાવન ગજનો વિસ્તારજી;
ઉપર ચક્ર ચડાવવા, મનુષ્ય મળ્યું છે અપારજી.
પ્રગટ પ્રછોરે ગાર ઇમામનો. ૧૪૨

મેહેનત કરે સૌ મળી, ચક્ર ચડાવવા તેણીવારજી;
ઘણી પ્રકારે મહેનત કર્યાં, ચક્ર ચડયું નહિ લગારજી.
પ્રગટ પ્રછોરે ગાર ઇમામનો. ૧૪૩

ચક્ર જ્યારે ચડયું નહિ, સર્વ વિચારે મનમાહીંજી;
એકે ઉપાએ ચાલ્યો નહિ, નકલ લોક તેડયા બહુજી.
પ્રગટ પ્રછોરે ગાર ઇમામનો. ૧૪૪

મેહેનત કરી ત્યાં અતી ઘણી, ચક્ર ચડયું નહિ તેણીવારજી;
શોકાતૂર સૌ શેવક થયા, કામ બને કેવાં ત્યાંએજી.
પ્રગટ પ્રછોરે ગાર ઇમામનો. ૧૪૫

realpatidar.com

https://archive.org/details/bk590/page/n34/mode/1up

1908-10-27 -Imam Shah Bavana Prachha (590)

realpatidar.com

અરજ કરે ત્યાં ઇમામને, તું છું જુગનો આધારજી;
ચક્ર ચડાવ્યું ચડે નહિ, કારણ બન્યું શું કિરતારજી.
પ્રગટ પછોરે ગોર ઇમામનો. ૧૪૬
દુનીયામાં કોઈ બીજો નહિ, તુજ વીનાં ત્રિભોવનરાએજી;
તારા નામનું ચક્ર ચડે નહિ, કારણ આ શું કહેવાયજી.
પ્રગટ પછોરે ગોર ઇમામનો. ૧૪૭
અરજ સુણી શેવક તણી, વારે ચડયા તેણીવારજી;
ફકીરી વેષે પંડે આવીયા, આવ્યા જગ્યામાં તેણીવારજી.
પ્રગટ પછોરે ગોર ઈમામનો. ૧૪૮
ભેગા થયા સૌ મળી, આપે બોલ્યા ત્રિલોકી નાથજી;
કેમરે કારણ સોખાતુર થયા, એવું પૂંછે તેણીવારજી.
પ્રગટ પછોરે ગોર ઇમામનો. ૧૪૯
એવી રીતે જ્યારે પૂંછીયું, સૌકો બોલ્યા તેણીવારજી;
ચક્ર ચડાવવા મેહેનત કરી, એકે ચાલ્યો નહિ ઉપાયેજી.
પ્રગટ પછોરે ગોર ઇમામનો. ૧૫૦
એવું સુણી આપે ઓચર્યા, સરવે સુણોને તમામજી;
'મેહેનત કરીયે ચાલો સૌ મળી, નામ લેઇને ઈમામજી.
પ્રગટ પછોરે ગોર ઈમામનો. ૧૫૧

realpatidar.com

વચન સુણી સૌ ઉઠીયા, ચક્ર ચડાવે તેણી વારજી;

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk590/page/n35/mode/1up

1908-10-27 -Imam Shah Bavana Prachha (590)

realpatidar.com

આપે હાથ જ્યાં અડાડીયો, ચક્ર ચડ્યું તેણી વારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૫૨

એકદમ ચક્ર જ્યાં ચડ્યું. આનંદ થયો સૌને ત્યાંએજી;
તેરે સમે તેરે ગોર તણો મરમ ના જાણ્યો લગારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૫૩

પછી આઘેરા ચાલીયા, અલોપ થયા ગોર ઇમામજી;
સોધ્યા પણ જડયા નહિ, બધે તપાસ્યું તમામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૫૪

એવી રીતે ગોરે કામ કર્યા, કુડા કલજુગની માંહેજી;
આપે પ્રગટ જાંબુદ્વિપમાં, પ્રગટ પ્રછો દેખો ત્યાંહેજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૫૫

એ પછી એક અવસર વિષે, ગોરે કર્યું એક કામજી;
કલજુગ કુડો ઘણો વાપીયો, તેમાં ગોરે કર્યાં કામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૫૬

વાત પરમુખે જેવી શાંભળી, તેવી કીધી છે વિસ્તારજી;
માટે કરી સાને અરજ કરૂ, દોષ નાં ગણશો લગારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૫૭

સંવત વિક્રમનો જે કેયે, ઓગણીસેં ચોતરીશની સાલજી;
માસ ભાદરવો ભરપૂરમાં, કામ બન્યું એક વિસ્તારજી.
realpatidar.com
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૫૮

https://archive.org/details/bk590/page/n36/mode/1up

realpatidar.com

નથુ કાકા જ્યારે હક થયા પછી, ગાદીએ બેશે તે કાણજી;
સરવે ત્યાં વિચારીયું, ગાદી બેડયાના કરે ઉપાએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૫૯

જમાત સર્વેને તેડાવીઆ, આવી મલ્યા સર્વે ત્યાંએજી;
સર્વે મળી વાત ગાદી તણી, કરે છે વારંમ વારજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૬૦

ઠરાવ કરતાં થંભી રહ્યા, દીવસ ત્રણ થયા ત્યાંહેજી;
માંહે માંહે મતે બોલીયા, અતી અકળાણી જમાતજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૬૧

મત નાં ચાલ્યો મોટા તણો, ગોરે જાણ્યું ખોટું કહેવાયેજી;
દ્રડ ભરૂંસો દેવા દાશને, ધણી મારો કેવાં કરે કામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૬૨

શું જાણે સહુકાર સેઠાયો, ગીરમથા ગામનો રહેવાસીજી;
ગોર સપનામાં તેને આવીયા, વાત કરી છે વિસ્તારીજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૬૩

તું જા ભાઇ જગ્યા વિષે, વિવેકે કરો જઇને વાતજી;
કહું તે પ્રમાણે તમે જઇ કહો, તઇ સૌ મલી છે જમાતજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૬૪

વાદ વિવાદ કરવો નહિ, કહ્યા પ્રમાણે કરો કામજી;
રોજા સદ્દગોરનાં સામા રહી, બેઠી પેરો સૌ આજજી.

https://archive.org/details/bk590/page/n37/mode/1up

1908-10-27 -Imam Shah Bavana Prachha (590)

realpatidar.com

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૬૫

સનમુખ થઇને ચલાવજો, બેડી તૂટે જેની ત્યાંએજી;
બેડી તૂટે તે ગાદી તણો, સતૂ મુજાવર કહેવાએજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૬૬

એ રીતે જઇને કહો, ગોરે કહ્યું સવપના માંહેજી;
પ્રભાતે આવ્યો પોતે પ્રેમથી, આવ્યો રોજાની માંહેજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૭૬

જાણ કરી સૌ જમાતને, વિસ્તારી કીધા વાતજી;
વાત સૂણી સહુકાર તણી, ખુશી થઇ છે જમાતજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૬૮

વાત ગમી સૌ સાદાતને, વળી કાકા સૌને ત્યાંએજી;
એવું સૂણીને આનંદ થયા, બેડી પેરાવ્યાને કરે ઠરાવજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૬૯

સૈયદ સૌ ભેગા થયા, કાકા બોલાવ્યા સૌ ત્યાંએજી;
બેડી પેરી સનમુખ ચાલે, ઘણી મારો કેવાં કરે કામજી.
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૭૦

બેડી પેરીને એક ચાલીયા, રોજા સામું તેણી વારજી;
પ્રગટ બેડી પણ તૂટે નહિ, બીજાને પેરાવે તેણી વારજી.
realpatidar.com
પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૭૧

https://archive.org/details/bk590/page/n38/mode/1up

realpatidar.com

તેની પણ તૂટી નહિ, એકાએક પેરી તમામજી;
કોઇની બેડી પણ તૂટી નહિ, કાકા કરમસી રહ્યા એકજી.
પ્રગટ પછોરે ગોર ઇમામનો. ૧૭૨
બેડી જ્યારે તૂટી નહિ, સરવે થયા મન ઉદાસજી;
સરવે મલી મન વિચાર કરે, ગોરને કરે છે અરદાસજી
પ્રગટ પછોરે ગોર ઇમામનો. ૧૭૩

રાગ છપ્પો.

ધન્ન ધન્ન ગોર ઇમામ, અરજ સુણોને અમારી;
આ અવશરમાં આજ, લજ્જા જાએ તમારી;
કલી કાલમાં કામ, કોઇ આવું નવ કીજે;
દયા કરી દિલમાંએ, દ્રઢ ભરૂસો દીજે;
સાચા કરો હો સમરથ ધણી, આજ કઠણ કળી કાળમાં;
કહે બંન્ધુ દો પારખું, આપે છો પ્રગટ હાલમાં. ૧

રાગ પ્રછાનો.

એવી રીતે જ્યારે અરજ કરી, ગોરછે લજ્જા રાખણહારજી;
શેવક સર્વની સાએ કરો, વેગે આવો આણી વારજી.
પ્રગટ પછોરે ગોર ઇમામનો. ૧૭૪
સાદાત સર્વે ફરમાવીયું, કાકા કરમસીને ત્યાંએજી;
બેડી પેરો તમે પ્રેમથી, રાજી થઇ કહે જમાતજી.

realpatidar.com

https://archive.org/details/bk590/page/n39/mode/1up

1908-10-27 -Imam Shah Bavana Prachha (590)

realpatidar.com

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૭૫

કાકા કરમસી ત્યાં બોલીયા, જમાત સુણો તમામજી;
એવું મારે ભાઈ નવ જોઇએ, ગોરને શોંપ્યાનો અધિકારજી.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૭૬

ફરી સાહાતે ફરમાવીયું, બેડી પેરી તેણી વારજી;
અરજ કરે ગોર ઇમામને, દાશની વેગે કરો સારજી.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૭૭

સ્તુતી સુણી શેવક તણી. ધણી મારે કરોછે કિ્રપાએજી;
નામ ઇમામનું લેઇ ચાલીયા, બેડી ભડાક ભાંગી ત્યાંએજી.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૭૮

જયજયકાર ત્યાં થૈ રહ્યો, આનંદ થયો સૌને ત્યાંએજી;
નગારા નોબત ડંકા વાગીયા, આરતી ગોરની ઉતરાએજી.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૭૯

સરવે મળી ગાદી પાસે, કરમસી કાકાને બેસરાવેજી;
નામ ઇમાનનું લેઇ કરી, પ્રેમે પાઘડી બંધાવેજી.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૮૦

ધન ધન ગોર ઇમામને, ધન્ન ધન્ન તમારા તે દાશજી;
દેવ ઘણા છે દુનિયા વિષે, પ્રગટ પ્રછો નહિ કાંએજી.

પ્રગટ પ્રછોરે ગોર ઇમામનો. ૧૮૧

realpatidar.com

પ્રગટ પ્રછા એવા પૂરીયા, મણુતા ગણી ના સકાએજી;

realpatidar.com

realpatidar.com